

(15)



R A N - 1 0 2 4



RAN-1024

TYBSc. (Sem-V) Examination

March / April - 2019

Dyes (CAN) [Generic Elective]

(15)

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

નીચે દર્શાવેલા નિશાળીવાળી વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the details of signs on your answer book

Seat No.:

<input type="text"/>					
----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------

Name of the Examination:

TYBSc. (Sem-V)

Name of the Subject :

Dyes (CAN) [Generic Elective]

Subject Code No.: **1 0 2 4**

Student's Signature

(1) પ્રશ્ન ન-૧ ના બધા જ પેટા પ્રશ્નો ફરજિયાત છે.

(2) જમણી બાજુના અંક પ્રશ્નનાં પૂરા ગુણ દર્શાવે છે.

(3) જવાબો ટૂંકા અને મુદ્દાસર લખો.

પ્ર-૧ નીચેનાં પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો.

૫

૧) પ્રાથમીક એરોમેટીક અને એલીક્ટીક એમાઈનમાં અસ્થાયી ડાયેજોનિયમ આયનની રાસાયણિક પ્રક્રિયા જણાવો.

૨) વાહકીય રંગકામ એટલે શું?

૩) રંગ વર્ધકનાં કાર્યો લખો.

૪) ઇન્ડિગોમાં પાણીમાં દ્રાવ્ય લ્યુકો કાર રંગકામ પ્રક્રિયા દ્વારા મેળવો.

૫) ઇન્ડાન્થ્રીન કાર્બોઝિલનું રાસાયણિક સૂત્ર અને ઉપયોગ લખો.

પ્ર-૨ નીચેનામાંથી કોઈપણ ત્રણનાં જવાબ લખો.

૧૫

૧) H - એસિડની આધ્યાત્મિક અને એસિડિક માધ્યમમાં P - નાઇટ્રોબેન્જીન ડાયેજોનિયમ કાર સાથે પુષ્ટીકરણ પ્રક્રિયા લખો. રંગ ઉદ્યોગમાં વપરાતા એન્થ્રાક્લિવનોન મધ્યવર્તી સંયોજનોનાં નામ અને બંધારણ આપો.

૨) બીસ એઝો ડાય વ્યાખ્યાયીત કરો. ઈરિયોકોમ બ્લેક A નું સંશ્લેષણ અને ઉપયોગ લખો.

- 3) એનિસોલ સમૂહમાં સંયોજન નામ અને બંધારણીય સૂત્ર લખો. બ્રોમામીન એસિડનું સંશ્લેષણ અને વારુનિ આપો.
- 4) મોનો અને પોલી એઝો રંગક એટલે શું? ડાયસ્કેટ બ્લેક EW નું સંશ્લેષણ અને ઉપયોગ લખો.
- 5) ઓરેંજ II અને ઓરેંજ IV વચ્ચેનો બંધારણીય તફાવત જણાવો. ફાસ્ટસલ્ફોન બ્લેક F નું સંશ્લેષણ અને વારુનિ આપો.

પ્ર-૩ નીચેનામાંથી કોઈ પણ ગ્રાણના જવાબ આપો.

- 1) એસિટેનીલાઇડમાં ક્રીટો-ઈનોલ ટોટોમેરીઝમ સૂત્ર લખી એસિટેનીલાઇડમાં ક્લોરીનેશન પ્રક્રિયા દ્વારા મળતા વારુંકનું સંશ્લેષણ અને ઉપયોગ લખો.
- 2) પીઝેન્ટ યલો G ની બનાવટમાં FCR માટે વપરાતા કાર્બનીક પદાર્થનું નામ જણાવો. પીઝેન્ટ ઓરેંજ VI નું સંશ્લેષણ અને વારુનિ લખો.
- 3) વિભેરણ રંગકનાં પ્રકાર આપી. ગોલ્ડન યલો VIII ની બનાવટ અને ઉપયોગ લખો.
- 4) વીટાઝ થીયરીના આધારે રંગકનાં પ્રકાર લખી. એઝોઈક રંગક, સ્થાપક રંગક, એસિડ બેઈજ રંગક, સલ્ફર રંગક પદો સમજાવો.
- 5) પ્રત્યેક રંગીન પદાર્થ રંગક નથી શા માટે? રંગકો અને વારુંકો વચ્ચેનો ભેટ ઉદાહરણ સાથે સમજાવો.

પ્ર-૪ નીચેનામાંથી કોઈ પણ ગ્રાણના જવાબ લખો.

- 1) કુદરતી રંગકો અને કુદરતીખોતમાથી ઈન્ડિગોની પ્રાપ્તિ પર ટૂંકનોંધ લખો.
- 2) પરતંત્ર રંગમૂલક એટલે શું? કાર્બોસાયક્લિક સંયોજનનું વર્ગીક્રણ કરી બેન્જેન્થોન વ્યુત્પન્ન સમજાવો.
- 3) ઉદાહરણ સાથે નીચેના પદો વ્યાખ્યાયિત કરો.
 - (a) ફૂત્રિમ રંગકો
 - (b) ઈન્ડિગોના હેલોજન વ્યુત્પન્ન
 - (c) એસેટિક રંગવર્ધક
 - (d) ઈન્ડાન્થ્રીન
 - (e) એસાઈલ એમીનો એન્થ્રાકિવનોન વ્યુત્પન્ન
- 4) ઈફેમેન બ્રોમાઇડ પ્રક્રિયા દ્વારા ઈન્ડિગોટીનનું સંશ્લેષણ વારુનિ સાથે લખો.
- 5) ઈન્ડાન્થ્રીન રેડ વાયોલટ RRN સંમિતિય છે જ્યારે ઈન્ડાન્થ્રીન સ્કારલેટ-B અસંમિતિય છે. રાસાયણિક પ્રક્રિયા સાથે સમજાવો.

Instructions:

- (1) All sub questions of question No. 1 are compulsory.
- (2) Figures to the right indicate full marks of the questions.
- (3) Write short and to the point answer.

Que : 1. Answer the following question in short. (5)

- 1) State unstable diazonium ion chemical reaction in primary aromatic and aliphatic amine.
- 2) What are carrier dyeing?
- 3) Write function of Auxochrome.
- 4) Obtain water soluble leucosalt by dyeing reaction in Indigo.
- 5) Write chemical formula and use of carbazole Indanthrene.

Que : 2 Answer any three of the following. (15)

- 1) Write coupling reaction of H-Acid in alkaline and acidic medium with P-nitrobenzene diazonium salt give name and structures of Anthraquinone-intermediates used in dyestuff industry.
- 2) Define Bisazodye. Write the synthesis and use of Eriochrome Black A.
- 3) Write the name of compounds with structural formula in anisole group. Give the synthesis and description of bromamin acid.
- 4) What are Mono and Poly azo dye? Give the synthesis and use of direct black EW.
- 5) State structural difference between orange - II and orange - IV give the synthesis and description of fast sulfone Black F.

Que : 3 Answer any three of the following. (15)

- 1) Write the Keto-enol tautomerism formula acetanilide. Give the synthesis and use of pigment obtain by chlorination reaction of acetanilide.
- 2) State useful organic substance for FCR preparation of pigments yellow G, write the synthesis and description of pigment orange - VI.
- 3) Give the type of disperse dye write the synthesis and use of golden yellow VIII.
- 4) Write the type of dyes with references to Witt's theory. Explain Azoic dye, Mordant dye, Acid base dye, Sulphur dye terms.
- 5) Each coloured substance is not dye why ? Explain difference between dyes and pigments with example.

Que : 4 Answer any three of the following.

(15)

- 1) Write short note on Natural dyes and Indigo obtain from natural sources.
 - 2) What is dependent chromophore? Explain Benzenethrone derivative of carbocyclic components with classification.
 - 3) Define following term with example.
 - (a) Synthetic dyes
 - (b) Halogen derivative of Indigo
 - (c) Acidic auxochrome
 - (d) Indanthrene
 - (e) Acyl amino anthraquinone derivative
 - 4) Give the synthesis of Indigatin by hofmann bromide reaction with description.
 - 5) Explain with chemical reaction. Indanthrene red violet RRN is a symmetrical while indanthrene scarlate B is a symmetrical.
-



R A N - 1 0 1 7

RAN-1017

T.Y.B.Sc. Sem V Examination

March / April - 2019

Chemistry Paper VII (Organic Chemistry)

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

(૧)

નીચે દર્શાવેલ કોઈ નિશાનીવાળી વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the details of ➡ signs on your answer book

Name of the Examination:

➡ T.Y.B.Sc. Sem V

Name of the Subject :

➡ Chemistry Paper VII

Subject Code No.: 1 0 1 7

Seat No.:

<input type="text"/>					
----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------

Student's Signature

(૨) જમણી બાજુના અંક પ્રશ્નના પૂરા ગુણ દર્શાવિ છે.

(૩) જવાબો ટૂંકમાં અને મુદ્દાસર લખો.

પ્ર-૧ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો:

(૫)

- (૧) સામાન્ય એસ્ટર અને જેન્થેટ એસ્ટરના એક-એક ઉદાહરણ આપો.
- (૨) પિરિડોક્સિનમાં એક ફીનોલીક -OH સમૂહની દાજરી કેવી રીતે પારખશો?
- (૩) આલ્કોહોલમાં મિથીલિન ડાયોક્સિલ સમૂહની દાજરી કેવી રીતે પારખશો?
- (૪) માલ્ટોજમાં બે મોનોસેક્ટેરાઇડ અણુઓનું જોડાણ α છે એ કેવી રીતે નક્કી કરી શકાય?
- (૫) ડેપ્સોનનું બંધારણીય સૂત્ર આપો.

પ્ર-૨ નીચેનામાંથી ગમે તે ગ્રણ પ્રશ્નોના ઉત્તર લખો.

(૧૫)

- (૧) ઇથાઇલ સક્સિનેટનું H_2O^{18} વડેનું જળવિભાજન કિયાવિધિ સાથે સમજાવો.
- (૨) એમાઈડના નિર્માણની કિયાવિધિ આપો.
- (૩) રિબોફ્લેવીનનું કોઈપણ એક સંશ્લેષણ આપો.

- (૪) પૂરવાર કરો : થાયરોક્સીન ઈથર કેન્દ્ર ધરાવતો α -એમિનો એસિડ છે.
 (૫) ' B_{AL}^2 ' પ્રક્રિયાની કિયાવિધિ સમજાવો.

પ્ર-૩ નીચેનામાંથી ગમે તે ત્રણ પ્રશ્નોના ઉત્તર લખો.

- (૧) પાપાવેરીનની અનુક્રમે ઠંડા-મંદ $KMnO_4$ તથા ગરમ $KMnO_4$ સાથેની પ્રક્રિયાઓ સૂત્રબદ્ધ કરી અનુમાન તારવો.
 (૨) નિકોટીનનું બંધારણ નક્કી કરવામાં પાઈનર પ્રક્રિયાની અગત્યતા સમજાવો.
 (૩) લેટોઝના બંધારણમાં ઓક્સિડેશન, મિથાઇલેશન અને જળવિભાજન પ્રક્રિયાની અગત્યતા સમજાવો.
 (૪) β -એમિલોડનું બંધારણ સમજાવો.
 (૫) (a) આલ્કલોઈડમાં દાજર $-N-CH_3$ સમૂહની દાજરી નક્કી કરવાની તથા પરિમાપન કરવાની હર્જિંગ મેયર પદ્ધતિ સમજાવો.
 (b) માલ્ટોઝનું બંધારણ નક્કી કરવા માટે જેમ્પેલેનનું કાર્ય સમજાવો.

પ્ર-૪ નીચેનામાંથી ગમે તે ત્રણ પ્રશ્નોના ઉત્તર લખો.

- (૧) ડાયાઝેપામનું સંશ્લેષણ તથા ઉપયોગો આપો.
 (૨) પાપયરીમિથેમાઈનનું સંશ્લેષણ તથા ઉપયોગો આપો.
 (૩) પેપ્ટાઈડના સંશ્લેષણની મેરિફિલ્ડ પદ્ધતિ વર્ણવો.
 (૪) પેપ્ટાઈડ આગુના N -અંતિમ સમૂહ નક્કી કરવાની સેન્ચરની રીત વર્ણવો.
 (૫) (a) વિવિધ દૈહિક તંત્રો પર અસર કરતાં ઔષ્ણ્ણો પૈકી કોઈપણ બે ઉપવર્ગો એક એક ઉદાહરણ સહિત આપો.
 (b) પ્રોટીનનું પ્રાથમિક બંધારણ સમજાવો.

ENGLISH VERSION

Q : 1 Answer the following questions in short.

- (1) Give one illustration each of common ester and xanthate ester.
 (2) How will you detect the presence of a phenolic -OH group in pyridoxine?
 (3) How will you detect the presence of methylene dioxyl group in an alkaloid?
 (4) How can it be determined that the linkage of two monosaccharide molecules in maltose is α ?
 (5) Give structural formula of dapsone.

Q : 2 Answer any three questions of the following [15]

- (1) Explain hydrolysis of ethyl succinate by H_2O^{18} with reaction mechanism.
(2) Give reaction mechanism of the formation of an amide.
(3) Give any one synthesis of riboflavin.
(4) Prove that thyroxin is an α -amino acid having ether center.
(5) Explain reaction mechanism of B_{AL}^2 reaction.

Q : 3 Answer any three questions of the following. [15]

- (1) Formulate the reaction of papaverine with cold-dilute $KMnO_4$ and hot $KMnO_4$ respectively and derive inference.
(2) Explain the importance of Pinerr's reaction in determining the structure of nicotine.
(3) Explain the importance of oxidation-methylation and hydrolysis in the structure of lactose.
(4) Explain the structure of β -amylose.
(5) (a) Explain Herzig Meyer method of determining the presence and the estimation of $-N-CH_3$ group in alkaloid.
(b) Explain Zemplen's work in determining the structure of maltose.

Q : 4 Answer any three questions of the following. [15]

- (1) Give synthesis and uses of diazepam.
(2) Give synthesis and uses of pyrimethamine.
(3) Describe Merry Field method for peptide synthesis.
(4) Describe Sanger's method of determining N-terminal group in peptide molecule.
(5) (a) Give any two sub-classes of drugs having pharmacological actions with one illustration of each.
(b) Explain primary structure of protein.

[5]



R A N - 1 0 1 8

RAN-1018

Third Year B.Sc. (Sem. V) Examination

March / April - 2019

Chemistry : Paper - VIII

(Physical Chemistry)

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

(૧)

નીચે દર્શાવેલ નિશાનીવાળી વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the details of signs on your answer book

Name of the Examination:

Third Year B.Sc. (Sem. V)

Name of the Subject :

Chemistry : Paper - VIII

Subject Code No.:

1	0	1	8
---	---	---	---

Seat No.:

<input type="text"/>					
----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------

Student's Signature

(૨) જમણી બાજુના અંક પ્રશ્નના પૂરા ગુણ દર્શવી છે.

(૩) જરૂર જણાય ત્યાં આકૃતિ દોરો.

પ્ર.૧. ટૂંકમાં જવાબ આપો.

૫


- ૧) ઉભાગતિશાસ્ત્રના ત્રીજા નિયમને આધારે પાણીનો સ્ફીટિક સંપૂર્ણ નથી. શા માટે?
- ૨) થર્મોડાયનેમિક રાશિઓ ક્ષ્યુગાસીટી અને સક્રિયતાની સૌ પ્રથમ રજૂઆત કરનાર વૈજ્ઞાનિકનું નામ આપો.
- ૩) $Fe|Fe^{2+}||Cu^{2+}|Cu$ કોષ માટે $25^{\circ}C$ તાપમાને કોષ પ્રક્રિયા અને કોષ પોટેન્શિયલ માટેનું સમીકરણ લખો.
- ૪) સિલ્વર અને મરદ્યુરસ દ્રાવ્યકારો ધરાવતા દ્રાવણમાં ક્ષાર સેતું તરીકે ક્યો પદાર્થ વપરાય છે?
- ૫) યુરેનિયમના બે સમર્થાનિકોના સૌપ્રથમવાર અલગન માટે ક્યા સિધ્યાંતનો ઉપયોગ કરવામાં આવ્યો?

પ્ર.૨. નીચેના પૈકી કોઈપણ ત્રણના જવાબ આપો.

- ૧) ઉભાગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ લખો અને તેની સમજૂતિ આપો.
- ૨) ઘન Mo ની અણુઉભાક્ષમતા નીચેના સમીકરણથી દર્શાવામાં આવી છે.

$$C_p = 5.69 + 1.88 \times 10^{-3} T - \frac{0.503 \times 10^5}{T^2} \quad \text{જ્યારે તેને } 0^\circ\text{C} \text{ થી } 2620^\circ\text{C} \text{ સુધી ગરમ કરવામાં આવે ત્યારે એન્ટ્રોપીનો ફેરફાર ગણું.}$$

- ૩) વાયુઓની ફ્લુગાસિટી નક્કી કરવાની આલેખી રીતનું વર્ણન કરો.
- ૪) 25°C તાપમાને બેન્જિનની બનાવટ માટેની પ્રમાણિત એન્ટ્રોપી ગણું.




$$S^\circ_{H_2} = 31.21 \text{ e.u.}, S^\circ_C = 1.35 \text{ e.u.} \quad \text{અને} \quad S^\circ_{C_6H_6} = 41.3 \text{ e.u.} \quad \text{અને} \quad \Delta H^\circ = 11720 \text{ Cal} \quad \text{દોષ ત્યારે} \quad \Delta G^\circ \text{ પણ ગણું.}$$

- ૫) આંશિક મોલલ મુક્તશક્તિ એટલે શું? સમીકરણ $\sum n_i d_i \mu_i = 0$ = મેળવો.
(જ્યાં μ = ઘટકોના રાસાયણિક વિભવ, n = મોલની સંખ્યા)

પ્ર.૩. નીચેના પૈકી કોઈપણ ત્રણના જવાબ આપો.

- ૧) વિદ્યુત રાસાયણિક કોષનું વર્ગીકરણ કરો. નિર્ગમન વગરના વિદ્યુત વિભાજ્ય સાંક્રતા કોષના ઈ.એમ.એફ. માટેનું સૂત્ર તારવો.

- ૨) પ્રક્રિયાઓ (i) $Fe^{2+} + 2\bar{e} = Fe$



પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ અનુક્રમે $-0.441V$ અને $+0.771V$. છે.


પ્રક્રિયા (iii) $Fe^{3+} + \bar{e} = Fe$ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ગણું.

- ૩) નોંધ લખો.

૧) વિદ્યુતરાસાયણિક શ્રેણી

૨) પ્રમાણિત વેસ્ટન કોષ

- ૪) 298k તાપમાને નિર્ગમન સાથેના કોષ



નો ઈ.એમ.એફ. $0.02802V$ છે. આજ કોષને અનુવર્ત્તી નિર્ગમન વગરના કોષનો ઈ.એમ.એફ. $0.01696V$ છે. હાઇડ્રોજન આયનનો નિર્ગમન આંક અને પ્રવાહી જંક્શન પોટેન્શિયલ ગણું.

૫) દ્વિતીય સંદર્ભ વિદ્યુતધ્રુવ એટલે શું? યોગ્ય ઉદાહરણ દ્વારા દ્વિતીય સંદર્ભ વિદ્યુતધ્રુવની રચના અને કાર્ય સમજાવો.

પ્ર.૪. નીચેના પૈકી કોઈ ખાણ ત્રણાના જવાબ આપો.

- ગરમ ૧.) “દિશા કેન્દ્રીકરણ દળ સ્પેક્ટ્રોમીટર” નો સિદ્ધાંત અને કાર્ય પદ્ધતિ આપો. તેની મહદ્દી સમસ્થાનિકોની સાપેક્ષ બહુલતા કેવી રીતે નક્કી કરવી તે જણાવો.
- ૨.) કેન્દ્રીય રસાયણમાં વપરાતા જુદા-જુદા પ્રક્રિયાઓ કેવી રીતે નક્કી કરવી તે જણાવો.
- ૩.) વીજભારયુક્ત કણોના પ્રવેગકો એટલે શું? સાઇક્લોટ્રોનમાં વીજભાર યુક્ત કણને (૧) મહત્વમાં શક્તિ માટેનું અને (૨) અર્ધવર્તુળકાર પથ પૂર્ણ કરવા માટેનું સમીકરણ પ્રાપ્ત કરો.
- ૪.) સમસ્થાનિકો એટલે શું? સમસ્થાનિકોના અલગીકરણમાં વપરાતી વિવિધ રીતો જણાવો. વિભાગીય નિસ્યંદન અને બાધ્યીભવનની રીત સમજાવો.
- ૫.) રેખીય પ્રવેગકનો સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ તેમજ ઉપયોગ લખો.

English Version

Instructions

- 1) As per the instruction no . 1 of page no 1
- 2) Figures on the right side indicate full marks of the questions.
- 3) Draw diagrams if necessary.

1. Answer in brief :


- 1) The crystal of water is not perfect according to the third law of thermodynamics. Why?
- 2) Name the scientist who proposed the thermodynamic terms fugacity and activity for the first time .
- 3) Write cell reaction and expression for the potential for $Fe|Fe^{2+}||Cu^{2+}|Cu$ cell at $25^{\circ}C$ temperature.
- 4) Which substance is used as salt bridge in solution having soluble salts of silver and mercurous?
- 5) Which principles was used to isolate two isotopes of uranium for the first time ?

2. Answer any three of the following

- 1) Write the third law of thermodynamics and give its explanation.
- 2) The molar heat capacity of solid Mo is given by the equation

$C_p = 5.69 + 1.88 \times 10^{-3} T - \frac{0.503 \times 10^5}{T^2}$. Calculate entropy change when it is heated from 0°C to 2620°C

- 3) Describe graphical method to determine fugacity of gases.
- 4) Calculate standard entropy for the formation of benzene at 25°C




$S^\circ_{H_2} = 31.21 \text{ e.u.}$, $S^\circ_C = 1.35 \text{ e.u.}$ and $S^\circ_{C_6H_6} = 41.3 \text{ e.u.}$ and also calculate ΔG° when $\Delta H^\circ = 11720 \text{ Cal.}$

- 5) What is meant by partial molal free energy? Derive the equation $\sum n_i d\mu_i = 0$ (where μ = chemical potential of components, n = number of moles)

3. Answer any three of the following

- 1) Classify the electrochemical cell. Derive an equation for e.m.f for an electrolyte concentration cell without transference.

- 2) The standard electrode potential for the reactions




(ii) $Fe^{3+} + e^- = Fe^{2+}$ are respectively -0.441V and $+0.771\text{V}$. Calculate the Standard electrode potential for the reaction (iii) $Fe^{3+} + 3e^- = Fe$

- 3) Write note on :

i) Electrochemical series.

ii) Standard Weston Cell.

- 4) The e.m.f of cell with transference



at 298k is 0.02802V . The corresponding cell without transference has an

15

emf of 0.01696 V. Calculate the transference number of hydrogen ion and the liquid junction potential.

- 5) What are secondary reference electrode? Explain the construction and working of secondary reference electrode giving suitable illustration.

it

4. Answer any three of the following

15

- 1) Give the principle and working method of direction focusing mass spectrometer, state how the relative abundance of isotopes can be determined with the help of it.
- 2) State different projectiles used in nuclear chemistry. Give equations only for two nuclear reactions induced by each projectile. Discuss the merits - demerits of different projectiles.
- 3) What are charged particles accelerators? Derive the relevant equations for
 - (i) Maximum energy that can be imparted to a particle and
 - (ii) The time taken to traverse the semicircular path in a given cyclotron.
- 4) What are isotopes? State various methods used for separation of isotopes. Explain fractional distillation and evaporation method
- 5) Write principle, Construction, Working method and uses of linear accelerator.

15

the



R A N - 1 0 1 9

RAN-1019

T.Y.B.Sc. (Sem-V) Examination

March / April - 2019

Chemistry Paper-IX
Industrial Chemistry

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

(૧)

નીચે દર્શાવેલ નિશાનીવાળી વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the details of signs on your answer book

Name of the Examination:

● T.Y.B.Sc. (Sem-V)

Name of the Subject :

● Chemistry Paper-IX

Subject Code No.: 1 0 1 9

Seat No.:

<input type="text"/>					
----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------

Student's Signature

- (૨) પ્રશ્ન નં. ૧ ના બધા જ પેટાપ્રશ્નો ફરજિયાત છે.
- (૩) જરૂર જણાય ત્યાં સમીકરણ આપો.
- (૪) જમણી બાજુના અંક પ્રશ્નના પૂરા ગુણ દર્શાવો.

પ્ર. ૧ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.

૫

- (૧) ફ્લોરોકાર્બન-114 નું રાસાયણિક નામ અને સૂત્ર આપો.
- (૨) ડાયનેલની બનાવટ આપો.
- (૩) મસ્કઅમ્બ્રેટનું બંધારણીય સૂત્ર આપો.
- (૪) નિકોમ મિશ્રધાતુમાં કઈ ઘાતુઓ હોય છે?
- (૫) ડામરની ગોળીનો ઉપયોગ આપો.

પ્ર. ૨ નીચેના પ્રશ્નોના જવાબ આપો. (ગમે તે ત્રણ)

૧૫

- (૧) બીસફિનોલ-A ની ઉત્પાદનવિધિ ફ્લોશીટ સહિત વર્ણવો.
- (૨) ક્લોરોપ્રીનની ઉત્પાદનવિધિ ફ્લોશીટ સહિત વર્ણવો.
- (૩) DMT બનાવવાની રીત આપો. DMT માંથી ડેકોનની બનાવટ આપો.

- (૪) દાઈફ્લોરો ઈથિનમાંથી ફિયોન-12 ની ઉત્પાદનવિધિ ફ્લોશીટ સહિત વર્ણવો.
 (૫) ક્લોરોફ્લોરો દાઈડ્રોકાર્બનોના ઉપયોગો વર્ણવો.

પ્ર. ૩ નીચેના પ્રશ્નોના જવાબ આપો. (ગમે તે ત્રણ)

- (૧) નાઈટ્રોટીંગ પક્કિયકો આપો. એસિટિલીનનું નાઈટ્રેશન ચર્ચો.
 (૨) વિસ્ટોટકોની બનાવટમાં નાઈટ્રેશન એકમ પદ્ધતિનો ઉપયોગ વર્ણવો.
 (૩) યોઝ્ય ઉદાહરણ આપો એમોનોલિસીસ વડે એમિનેશન ચર્ચો.
 (૪) આજોરંગાક અને નાયલોનની બનાવટમાં એમિનેશન એકમ પદ્ધતિનો ઉપયોગ વર્ણવો.
 (૫) સલ્ફોનેશન પદ્ધતિઓ આપો. સલ્ફોનેશન પ્રક્રિયાથી કિયાવિધિ આપો. સલ્ફોનેશન પ્રક્રિયાથી રિસોર્સિનોલની બનાવટ આપો.

પ્ર. ૪ નીચેના પ્રશ્નોના જવાબ આપો. (ગમે તે ત્રણ)

- (૧) ટંગસ્ટનના રાસાયણિક ગુણધર્મો આપો.
 (૨) એસિડ અને આલ્કલાઇન પદ્ધતિ વડે TiO_2 બનાવવાની રીત વર્ણવો.
 (૩) બેયર અને સરપેક પદ્ધતિ વડે એલ્યુમિનિયમ દાઈડ્રોક્સાઇડ બનાવવાની રીત વર્ણવો.
 (૪) મોલિઝેનમના ઉપયોગો આપો.
 (૫) દિવાસળી અને બુટ પોલિશ બનાવવાની રીત વર્ણવો.

ENGLISH VERSION

Instructions:

- (1) As per the instruction No. 1 of Page No. 1.
- (2) All sub questions of Q.1 are compulsory.
- (3) Give equations wherever necessary.
- (4) Figures to the right indicate full marks of the questions.

Q.1 Answer the following questions in short.

- (1) Give chemical name and formula of fluoro carbon-114.
- (2) Give preparation of dynel.
- (3) Give structural formula of musk ambrette.
- (4) Which metals are present in nichrome mix metal?
- (5) Give use of naphthalene balls.

Q.2 Answer the following questions. (Any three)

- (1) Describe the manufacturing process of Bisphenol-A with flow sheet.
- (2) Describe the manufacturing process of Chloroprene with flow sheet.
- (3) Give method of preparation of DMT. Give preparation of Dacron from DMT.

- 94
- (4) Describe the manufacturing process of Freon-12 from difluoro ethene with How sheet.
(5) Describe uses of Chloro fluoro hydrocarbons.

Q.3 Answer the following questions. (Any three)

15

- (1) Give nitrating reagents. Discuss the nitration of acetylene.
(2) Describe use of nitration unit process in the synthesis of explosives.
(3) Discuss animation by ammonolysis giving suitable illustration.
(4) Describe use of amination unit process in the preparation of azodye and nylon.
(5) Give sulphonation methods. Give mechanism of sulphonation reaction.
Give preparation of resorcinol by sulphonation reaction.

Q.4 Answer the following questions. (Any three)

15

- (1) Give chemical properties of Tungsten.
(2) Describe method of preparation of TiO_2 by acid and alkaline method.
(3) Describe method of preparation of $Al(OH)_3$ by Bayer's and Serpek's process
(4) Give uses of Molybdenum.
(5) Describe method of preparation of safety matches and shoe polish.
-

5

15

I.



R A N - 1 0 1 6

RAN-1016

B.Sc. (Sem. V) Examination

March / April - 2019

Inorganic Chemistry : Paper - VI

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

નીચે દર્શાવેલ એ નિશાનીવાળી વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the details of → signs on your answer book

Name of the Examination:

→ B.Sc. (Sem. V)

Name of the Subject :

→ Inorganic Chemistry : Paper - VI

Subject Code No.: 1 0 1 6

Seat No.:

--	--	--	--	--	--	--

--

Student's Signature

- (1) ટૂંકા અને મુદ્દાસર જવાબ આપો.
- (2) જમની બાજુના અંક પ્રક્રના પૂરા ગુણ દર્શાવો.

પ્ર. 1. નીચેના પ્રક્રના ટૂંકમાં જવાબ આપો:

5

- (1) હાઈડ્રોજન પરમાણુના શ્રોડિજરના તરંગ સમીક્રરણ પરથી ક્યા ક્વોન્ટમ અંકો મળે છે?
- (2) આર્થનો બોરેન્સનું સામાન્ય સૂત્ર જણાવો.
- (3) સંકીર્ણની પરિવર્તનશીલતા અને તેની સક્રિયકૃતશક્તિ વચ્ચેનો સંબંધ દર્શાવો.
- (4) લઘુ સ્પિન સંકીર્ણ કોને કહેવાય?
- (5) પીર્ટિંગ ક્ષારણ એટલે શું? તેના કોઈ પણ બે ઉદાહરણ જણાવો.

પ્ર. 2. નીચેનામાંથી કોઈપણ ત્રણના જવાબ આપો :

15

- (1) કારક એટલે શું? આઈગન સમીક્રરણ અને આઈગન કિમત સમજાવો.
- (2) હાઈડ્રોજન પરમાણુ માટેનું $\frac{1}{\phi} \cdot \frac{d^2\phi}{d\phi^2} = -m^2$ મેળવો.
- (3) ત્રિપરિમાણીય પેટીમાં રહેલા કણ માટેની શક્તિની કિમત માટેનું સૂત્ર મેળવો.
- (4) બોરેન હાઈડ્રોઇડમાં ત્રિ-કેન્દ્રિય-બે ઈલેક્ટ્રોન ($3c - 2e^-$) બંધ ઉદાહરણ સહિત સમજાવો.
- (5) પેન્ટાબોરેનમાં રચના અને બંધન સમજાવો.

Q.3. નીચેનામાંથી કોઈપણ ત્રણાના જવાબ આપો:

- (1) ટ્રાન્સ અસરના સ્થિતવીજ ધ્રુવીભવનવાદની ચર્ચા કરો.
- (2) પરિવર્તનશીલતા એટલે શું? પરિવર્તનશીલતાને અસર કરતાં પરિબળો જણાવો.
- (3) $[\text{FeF}_6]^{3-}$ સંકીર્ણ આપનનો શક્તિ સ્તર આકૃતિ દોરો અને ચુંબકીય ગુણધર્મ સમજાવો.
- (4) જાહેન-ટેલર સિદ્ધાંત સમજાવો. t^4 - ઉચ્ચ સ્પિન અને t^8 - નિમ્ન સ્પિન અષ્ટક્લડીય સંકીર્ણમાં વિકૃતિ સમજાવો.
- (5) ધાતુ સંકીર્ણના ઉભાગતિકીય તથા ગતિજ અભ્યાસનું મહત્વ સમજાવો.

Q.4. નીચેનામાંથી કોઈપણ ત્રણાના જવાબ આપો:

- (1) એનોહિક અને કેથોહિક નિરોધકો પર ટૂંકનોંધ લખો.
- (2) કારણ એટલે શું? કારણનો વીજ-રાસાયણિક સિદ્ધાંત સમજાવો.
- (3) આરછાદ એટલે શું? તેનાં પ્રકારો જણાવો.
- (4) ધાતુ કાર્બોનિલમાં પારક્ત વણપિટનો ઉપયોગ જણાવો.
- (5) $\text{Fe}(\text{CO})_5$ રચના અને બંધન ચર્ચા. તથા તેનો EAN ગણો.

ENGLISH VERSION

Instructions:

- (1) As per the instruction No. 1 of the page No. 1.
- (2) Write short and to the point answers.
- (3) Figures to the right indicate full marks of the question.

Q.1. Answer the following questions in brief:

- (1) Which quantum numbers are obtained from Hydrogen atom Schrodinger's wave equation ?
- (2) Give general formula of Arachno boranes.
- (3) Give relationship between lability and activation energy of complex.
- (4) What is called low spin complexes ?
- (5) What is pitting corrosion ? Give any two examples of it.

Q.2. Answer any three of the following :

- (1) What is operator ? Explain eigen equation and eigen value.
- (2) Obtain the equation $\frac{1}{\phi} \cdot \frac{d^2\phi}{d\phi^2} = -m^2$ for hydrogen atom.
- (3) Obtain the equation for energy of a particle in a three dimensional box.
- (4) Explain three centre-two electron ($3c - 2e^-$) bond in boron hydrides with suitable example.
- (5) Explain structure and bonding in pentaborane.

15

Q.3. Answer any three of the following :

15

- (1) Discuss the electrostatic polarization theory of trans effect.
- (2) What is lability ? Give the factors affecting lability.
- (3) Draw energy level diagram for $[\text{FeF}_6]^{3-}$ ion and explain its magnetic property.
- (4) Explain Jahn-Teller theorem. Explain distortion in d^4 high spin and d^8 low spin octahedral complexes.
- (5) Explain importance of thermodynamic and kinetic study of metal complexes.

15

Q.4. Answer any three of the following :

15

- (1) Write short note on "Anodic and Cathodic inhibitors".
 - (2) What is corrosion ? Explain electrochemical theory of corrosion.
 - (3) What is coating ? Give types of coating.
 - (4) Give uses of Infra-red spectrum in metal carbonyls.
 - (5) Discuss the structure and bonding in $\text{Fe}(\text{CO})_5$ and calculate its EAN.
-

5

15



R A N - 1 0 2 0

RAN-1020

T.Y.B.Sc. (Sem-V) Examination

March / April - 2019

Chemistry Paper-X (Analytical Chemistry)

[Total Marks: 50]

સૂચના : / Instructions

(1)

નીચે દર્શાવેલ નિશાનીવાળી વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the details of signs on your answer book

Name of the Examination:

→ T.Y.B.Sc. (Sem-V)

Name of the Subject :

→ Chemistry Paper-X (Analytical Chemistry)

Subject Code No.: 1 0 2 0

Seat No.:

<input type="text"/>					
----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------

Student's Signature

(2) જમણી બાજુના અંક પ્રશ્નનાં પૂરા ગુણ દર્શાવો.

(3) જવાબો ટૂંકમાં અને મુદ્દાસર લખો.

પ્ર.૧. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો.

(4)

(1) માપનના પુનઃનિર્માણને અસર કરે એવી ક્ષતિને કેવા પ્રકારની ક્ષતિ કહેવાય?

(2) પૂર્થકરણમાં વપરાતા વજન પ્રમાણિત ન હોય તો અનુમાપનમાં કેવા પ્રકારની માપ્ય ક્ષતિ દાખલ થાય?

(3) BaSO_4 ની 0.01M KNO_3 માં દ્રાવ્યતા તેની જલીય દ્રાવ્યતા કરતા આશરે 70% વધુ છે. શા માટે?

(4) ડિપ્રોટિક એસિડના બે ઉદાહરણ આપો.

(5) કાર્బોનેટ મિશ્રણના 0.8gm. નમૂનાને ફિનોલફેલીન અંત્યબિંદુએ પહોંચવા 0.1M HCl ના 16ml. અને મિથાઈલ ઓરેંજ અંત્યબિંદુએ પહોંચવા માટે વધારાના 33 ml. HCl ની જરૂર પડે છે તો કાર્બોનેટ મિશ્રણના ઘટકો જણાવો.

प्र.२. नीचेना प्रश्नोमांथी त्राणना जवाब लखो।

- (१) पद्धतिनी क्षति घटावानी प्रायोगिक रीतो सविस्तार समजावो।
 (२) तक्षावत स्पष्ट करो: (१) माप्य अने अमाप्य क्षति (२) चोकसाई अने पुनःनिमाशि।
 (३) साधनीय पद्धतिनुं वर्गीकरण आपो. आ पद्धतिना फायदा अने गेरफायदा वर्णवो।
 (४) एक विद्यार्थीनि NaOH नुं द्रावण प्रमाणित करता नीचेना परिणामो मળ्या.
 $0.0902, 0.0884, 0.0886, 0.1000$. आ परिणामोना जुथ माटे (१) मध्यक (२) मध्यरथ
 (३) विस्तार अने (४) प्रमाणित विचलन गणो।
 (५) परिणामोना जूथमांथी शंकाशील परीणामोनी अस्वीकृति माटे सरेराश विचलन पर आधारित
 नियमो समजावो।

प्र.३. नीचेना प्रश्नोमांथी त्राणना जवाब लखो।

- (१) $\text{CaC}_2\text{O}_4 \cdot \text{H}_2\text{O}$ अने $\text{MgC}_2\text{O}_4 \cdot 2\text{H}_2\text{O}$ ना ताप आलेखनी आकृति आपो अने तेमनी
 वर्चेनो तक्षावत स्पष्ट करो।
 (२) 'अवक्षेपना कणोनुं जुदु जुदु कड द्राव्यता अने अधिकाव्यताना तक्षावत पर आधार राखे छे'
 अधिसंतृप्ति वड वडे समजावो।
 (३) भारमापक पृथक्करणमां समांग द्रावणमांथी अवक्षेपननी उपयोगिता उदाहरण आपी
 समजावो।
 (४) Ag_2CrO_4 नी (i) शुद्ध पाणीमां अने (ii) $0.01\text{M} \text{ AgNO}_3$ मां मोलर द्राव्यता गणो。
 $(\text{Ag}_2\text{CrO}_4 \text{ नो } K_{sp} = 1.7 \times 10^{-12})$
 (५) सहअवक्षेपन अने पश्चाद् अवक्षेपननी व्याख्या आपो. अने सहअवक्षेपनना प्रकारो
 समजावो।

प्र.४. नीचेना प्रश्नोमांथी त्राणना जवाब लखो।

- (१) निर्बण डिबेजिक ऐसिड H_2B ना NaOH वडे करवामां आवता अनुमापन दरभ्यान
 NaHB ना द्रावणानुं pH शोधवानुं सूत्र साधित करो।
 (२) संक्षिप्तिय अनुमापनमां मास्कींग. डीमास्कींग अने गतिज मास्कींगनी उपयोगिता
 योग्य उदाहरण आपी समजावो।
 (३) 50 ml. 0.1 M निर्बण डिबेजिक ऐसिड H_2B नुं अनुमापन 0.1 M NaOH वडे
 करवामां आवे तो द्रावणानुं (i) 30ml अने (ii) 60ml NaOH नुं द्रावण उमेर्या पछी
 pH गणो. (H_2B माटे $K_{a_1} = 1 \times 10^{-3}, K_{a_2} = 1 \times 10^{-7}$)
 (४) 'असरकारक स्थिरता अथवांक' द्रावणानी pH असरना संदर्भमां समजावो अने संक्षिप्तिय
 अनुमापनमां तेनी उपयोगिता आपो।
 (५) धातु आयन सूक्ष्मकी डियाविधि योग्य उदाहरण आपी समजावो।

Instructions:

- (1) As per the instruction No.1 of page No.1.
- (2) Figures to the right indicate full marks of the question.
- (3) Write the answers briefly and to the point.

મધ્યરથ

Q.1. Answer the following questions in brief: (5)

- (1) What is the type of error called that affect the precision of measurement?
- (2) Which type of determinate error is introduced in titration when weights used in analysis are not calibrated?
- (3) The solubility of BaSO_4 in 0.01M KNO_3 is greater about 70% than its solubility in water. Why?
- (4) Give two examples of diprotic acid.
- (5) 0.8 gm. Sample of carbonate mixture required 16ml. 0.1M HCl to reach the phenolphthalein end point and additional 33ml HCl is required to reach methyl orange end point. Give components of the carbonate mixture.

ધારિત

૧૫

Q.2. Write any three answers of the following. (15)

- (1) Explain the experimental methods to minimize methodic errors.
- (2) Differentiate clearly between: (i) determinate and indeterminate errors (ii) accuracy and precision.
- (3) Give classification of instrumental methods. Describe advantages and disadvantages of these methods.
- (4) A student standardized a solution of NaOH and found the following results: 0.0902, 0.0884, 0.0886, 0.1000. Calculate
 - (i) Mean
 - (ii) Median
 - (iii) Range
 - (iv) Standard deviation for the set of results.
- (5) Explain the rules for the rejection of doubtful result from the set of results that are based on average deviation.

૧૫

Q.3. Write any three answers of the following. (15)

- (1) Draw thermo grams of $\text{CaC}_2\text{O}_4 \cdot \text{H}_2\text{O}$ and $\text{MgC}_2\text{O}_4 \cdot 2\text{H}_2\text{O}$. Clarify the difference between them.
- (2) 'The variation in particle size of the precipitates depends upon the difference between solubility and super solubility' explain with super saturation curve.
- (3) Explain the application of precipitation from homogeneous solution in gravimetric analysis with illustration.

માત્રિક

- (4) Calculate the molar solubility of Ag_2CrO_4 (i) in pure water and (ii) in 0.01M AgNO_3 , [K_{sp} of $\text{Ag}_2\text{CrO}_4 = 1.7 \times 10^{-12}$].
- (5) Define co-precipitation and post precipitation and explain types of co-precipitation.

4. **Write any three answers of the following.**

- (1) Derive the formula to calculate pH of NaHB solution during the titration of weak dibasic acid H_2B with NaOH .
 - (2) Explain the application of masking, demasking and kinetic masking in complexometric titration with suitable example.
 - (3) 50 ml. of 0.1 M weak dibasic acid H_2B is titrated with 0.1 M NaOH . Calculate the pH of the solution after addition of (i) 30 ml. and (ii) 60 ml. of NaOH solution. [For $\text{H}_2\text{B} \quad K_{\text{a}_1} = 1 \times 10^{-3}, K_{\text{a}_2} = 1 \times 10^{-7}$]
 - (4) Explain 'effective stability constant' with reference to effect of pH of the solution and give its application in complex metric titration.
 - (5) Explain the mechanism of metal ion indicators giving suitable example.
-



R A N - 1 0 2 1

RAN-1021

(15)

T.Y.B.Sc. (Sem-V) Examination

March / April - 2019

Chemistry Paper-XI (General Chemistry)

[Total Marks: 50]

સૂચના : / Instructions

(1)

નીચે દર્શાવેલ નિશાનીવાળી કિગતો ઉત્તરવટી પર અવશ્ય લખવી.
Fill up strictly the details of signs on your answer book

Name of the Examination:

T.Y.B.Sc. (Sem-V)

Name of the Subject :

Chemistry Paper-XI (General Chemistry)

Subject Code No.:

1	0	2	1
---	---	---	---

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

- (2) જમણી બાજુના અંક પ્રશ્નનાં પૂરા ગુણ દર્શાવી છે.
- (3) જવાબો ટૂંકમાં અને મુદ્દાસર લખો.
- (4) પરમાણુભાર : H=1; C=12; N=14; O=16; S=32; K=39; As=75; Mn=55; Cr=52

પ્ર. ૧. નીચેનાં પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ લખો.

(4)

- (1) મ્યુલ એટલે શું? મ્યુલિંગ એજન્ટના નામ જણાવો.
- (2) સમતલીય નમન આંદોલનો જણાવો.
- (3) પ્રાથમિક પ્રમાણિત સલ્ફામિક એસિડનું સૂત્ર લખો.
- (4) શા માટે Ba^{2+} આપન રંગીન જ્યોત આપે છે?
- (5) મોલાલિટીની વ્યાખ્યા આપો.

પ્ર. ૨. નીચેના પ્રશ્નોમાંથી ત્રણના જવાબ લખો.

(14)

- (1) કાર્બનિક પદાર્થોના IR વર્ણિપત્ર વિભાગ જણાવો. "ફિંગર પ્રિન્ટ વિભાગ" પર ટૂંકનોંધ લખો.
- (2) IR વર્ણિપત્રની તિત્રતા ક્યા પરિબળ પર આધાર રાખે છે? ક્રિપરમાણીય કોણીય અને રેખીય અણુંઘોના આંદોલનો આકૃતિ સંદર્ભ સમજાવો.

- (3) ઈથાઈન, એમોનિયા, બેન્જીન, સલ્ફર ડાયોક્સાઈડ અને હાઇડ્રોજન સાયનાઈડ અણુઓના ખેંચાણા, નમન અને કુલ આંદોલનોની ગણતરી કરો.
- (4) ટૂકનાં નિયમનું સમીક્ષરણ લખો. નીચેના બંધોની ખેંચાણ આવૃત્તિની ગણતરી કરો.

(1) C-H

(2) C=C

(3) C≡N

બળ અચળાંક એક બંધ માટે $f = 5 \times 10^5$ ડાઈન/સેમી.

દ્વિ બંધ માટે $f = 10 \times 10^5$ ડાઈન/સેમી.

ત્રિ બંધ માટે $f = 15 \times 10^5$ ડાઈન/સેમી.

એવોગ્ઝો આંક $N = 6.023 \times 10^{23}$

- (4) ડિક્રિપ્શન સ્પેક્ટ્રોફોટોમીટરનો ફ્લોચાર્ટ આપો. પ્રકાશનો સ્ત્રોત અને મોનોક્રોમેટર્સ સમજાવો.

પ્ર.૩. નીચેના પ્રશ્નોમાંથી ત્રણાના જવાબ લખો.

(૧૫)

- (1) Cu^{2+} ની NH_3 , Fe^{3+} ની SCN^- અને NH_4^+ ની નેસ્લર પ્રક્રિયક સાથેની સંકિણિતીય પ્રક્રિયા સમીક્ષરણ સહિત સમજાવો.
- (2) અકાર્બનિક ગુણાદર્શક પૃથ્વીકરણમાં બોરેક્સ મણાકા કસોટી સમજાવો.
- (3) લેસાઈન દ્રાવણમાં નાઈડ્રોજન, સલ્ફર અને લેલોજન તત્ત્વોના પરીક્ષણ માટેની કસોટી વર્ણવો.
- (4) ઝેરીગેસ શાસમાં લેવાય ત્યારે કરવામાં આવતી પ્રાથમિક સારવાર વર્ણવો.
- (5) કાર્બનિક પદાર્થની મંદ NaOH , મંદ NaHCO_3 અને ઈથરમાં દ્રાવ્યતા સમજાવો.

પ્ર.૪. નીચેના પ્રશ્નોમાંથી ત્રણાના જવાબ લખો.

(૧૫)

- (1) સપ્રમાણાતા, દ્રાવ્યતા અને મોલઅંશ ની વ્યાખ્યા આપો. 5.9 ગ્રામ સંકિસનીક એસિડ ધરાવતા 250 મિ.લી. દ્રાવણની મોલારિટી અને %W/V શોધો.
- (2) રિક્ષશન કર્તા પ્રાથમિક પ્રમાણિત પદાર્થનાં નામ લખો. પ્રાથમિક પ્રમાણિત પદાર્થ As(III) ઓક્સાઈડ વડે KMnO_4 નાં દ્રાવણને પ્રમાણિત કરવાની રીત વર્ણવો.
- (3) પોટેશિયમ અસિડ થેલેટનો તુલ્યભાર ગણાઓ. પ્રાથમિક પ્રમાણિત પોટેશિયમ અસિડ થેલેટ વડે પોટેશિયમ હાઇડ્રોક્સાઈડનાં દ્રાવણને પ્રમાણિત કરવાની રીત વર્ણવો.
- (4) ઓક્સિડેશનકર્તા અને એસિડીક પ્રાથમિક પ્રમાણિત પદાર્થના નામ આપો. પોટેશિયમ ડાયકોમેટ, સોડિયમ હાઇડ્રોક્સાઈડ અને સોડિયમ થાયોસલ્ફેટના દ્રાવણોને પ્રમાણિત કરવા વપરાતા પ્રાથમિક પ્રમાણિત પદાર્થના નામ જણાવો.
- (5) પ્રાથમિક પ્રમાણિત પદાર્થો અને ડિતિયક પ્રમાણિત દ્રાવણો સમજાવો. પ્રાથમિક પ્રમાણિત પદાર્થની શરતો લખો.

ENGLISH VERSION

Instructions:

- (1) As per the instruction No. 1 of page no. 1.
- (2) Figures to the right indicate full marks of the question.
- (3) Write the answers briefly and to the point.
- (4) Atomic weight : H=1; C=12; N=14; O=16; S=32; K=39; As=75; Mn=55; Cr=52.

Q.1. Answer the following questions in brief:

(5)

- (1) What is a mull? Give name of mulling agents.
- (2) State planar bending vibrations.
- (3) Write formula of primary standard sulfamic acid.
- (4) Why Ba^{2+} ion gives color flame?
- (5) Give definition of molality.

Q.2. Write any three answers of the following.

(15)

- (1) State the IR spectrum region of organic substances. Write a short note on "Finger print region".
- (2) On which factor intensity of IR spectrum depends? Explain the vibrations of tri atomic angular and linear molecules with figures.
- (3) Calculate the stretching, bending and total vibrations of ethyne, ammonia, benzene, sulfur dioxide and hydrogen cyanide.
- (4) Write formula of Hook's rule. Calculate stretching frequency of the following bonds:
 - (i) C-H
 - (ii) C=C
 - (iii) C≡N

Force constant For single bond $f = 5 \times 10^5$ dyne/cm.

For double bond $f = 10 \times 10^5$ dyne/cm.

For triple bond $f = 15 \times 10^5$ dyne/cm.

Avogadro number $N = 6.023 \times 10^{23}$

- (5) Give flow sheet diagram of double beam spectrophotometer. Explain source of light and monochromators.

(X)

Q.3. Write any three answers of the following. (15)

- (1) Explain complexometric reaction with equation for Cu^{2+} with NH_3 , Fe^{3+} with SCN^- ion and NH_4^+ with Nessler reagent.
- (2) Explain borax bead test in inorganic qualitative analysis.
- (3) Describe the detection of nitrogen, halogen and sulfur elements in a lassigne solution.
- (4) Describe the primary treatments done when the poisonous gas is Inhaled.
- (5) Explain the solubility of organic substances in dilute NaOH , dilute NaHCO_3 and ether solutions.

Q.4. Write any three answers of the following. (15)

- (1) Define normality, solubility and mole fraction. Find out molarity and % W/V of 250 ml solution containing 5.9 gm of succinic acid.
- (2) Write the name of primary standard reducing agents.
Describe standardization of KMnO_4 solution by primary standard substance As(III) oxide.
- (3) Calculate the equivalent weight of potassium acid phthalate. Describe method of standardization of potassium hydroxide solution by primary standard potassium acid phthalate.
- (4) Give name of oxidizing agent and acidic primary standard substances.
Write name of primary standard substances for standardization of potassium dichromate, sodium hydroxide and sodium thiosulphate solutions.
- (5) Explain primary standard substances and secondary standard solutions.
Write criteria of primary standard substances.